

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov - 2022 (NEW COURSE)
Management Accounting - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ એક કંપનીના વર્ષ 2020-21 અને 2021-22 ના પાકા સરવૈયા નીચે મુજબ છે:

(૨૦)

જવાબદારી	2020-21	2021-22	મિલકતો	2020-21	2021-22
પ્રેફરન્સ શેર	2,00,000	2,40,000	સ્થિર મિલકતો	9,08,000	10,18,000
ઈક્વિટી શેર	5,00,000	5,00,000	સ્ટોક	2,64,000	2,00,000
જામીનગીરી પ્રિમિયમ	12,000	16,000	દેવાદારો	1,00,000	1,08,000
ડિબેન્ચર	2,00,000	2,00,000	બેન્ક સિલક	16,000	14,000
પરચુરણ લેણદારો	2,92,000	2,56,000	ડિબેન્ચર વટાવ	12,000	10,000
સુચિત ડિવિડન્ડ	28,000	-----			
નફા નુકશાન ખાતુ	68,000	1,38,000			
	13,00,000	13,50,000		13,00,000	13,50,000

વધારાની માહિતિ:

1. વર્ષ દરમિયાન રૂ. 80,000 ની કિંમતના ચંત્રો રૂ. 84,000 ની કિંમતે વેચવામાં આવ્યા હતા.
2. વર્ષ દરમિયાન કાયમી મિલકતો પર રૂ. 28,000 ઘસારો માંડી વાળવામાં આવ્યો હતો.
3. વર્ષ દરમિયાન રૂ. 40,000 ના પ્રેફરન્સ શેર 10% ના પ્રિમિયમની બહાર પાડ્યા હતા.
4. વર્ષ દરમિયાન વર્ષ 2020-21 નું સુચિત ડિવિડન્ડ ચુકવ્યું હતું.

ઉપરની માહિતી પરથી ભંડોળ પ્રવાહ પત્રક, કાર્યશીલ મુડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને જરૂરી ખાતાઓ સાથે તૈયાર કરો.

અથવા

એક કંપનીના વર્ષ 2020-21 અને 2021-22 ના પાકા સરવૈયા નીચે મુજબ છે:

પ્રશ્ન.૧

જવાબદારી	2020-21	2021-22	મિલકતો	2020-21	2021-22
ઈક્વિટી શેર મુડી	1,80,000	2,00,000	પાઘડી	-----	1,600
સામાન્ય અનામત	20,000	24,000	જમીન-મકાન	1,80,000	1,68,400
નફા-નુકશાન ખાતુ	16,000	14,000	પ્લાન્ટ-મશીનરી	60,000	68,000
બેન્ક લોન	28,000	-----	સ્ટોક	40,000	32,000
પરચુરણ લેણદારો	64,000	62,000	પરચુરણ દેવાદારો	32,000	28,000
કરવેરાની જોગવાઈ	12,000	10,000	રોકડ-બેન્ક	8,000	12,000
	3,20,000	3,10,000		3,20,000	3,10,000

તા. 31/03/2022 ના રોજ પુરા થતા વર્ષ દરમિયાન:

1. રૂ. 10,000 નું ડિવિડન્ડ ચુકવ્યું હતું.
2. અન્ય કંપનીની મિલકતો રૂ. 20,000 માં ખરીદવામાં આવી હતી જેની ચુકવણી ઈક્વિટી શેર દ્વારા કરવાની હતી સ્ટોક રૂ. 8,000 અને મશીનરી રૂ.10,000
3. રૂ. 4,000 ની મશીનરી ખરીદવામાં આવી હતી.

4. રૂ. 14,000 ની કરવેરાની જોગવાઈ કરી હતી.

ઉપરની માહિતી પરથી ભંડોળ પ્રવાહ પત્રક, કાર્યશીલ મુડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને જરૂરી ખાતાઓ સાથે તૈયાર કરો.

પ્રશ્ન.૨ એક કંપનીના વર્ષ 2020-21 અને 2021-22 ના પાકા સરવૈયા નીચે મુજબ છે:

(૨૦)

જવાબદારી	2020-21	2021-22	મિલકતો	2020-21	2021-22
ઈકિવટી શેર મુડી	2,00,000	2,50,000	પાઘડી	-----	4,000
સામાન્ય અનામત	60,000	70,000	જમીન-મકાન	2,10,000	1,96,000
નફા-નુકશાન ખાતુ	40,000	35,000	પ્લાન્ટ-મશીનરી	1,50,000	1,70,000
બેન્ક લોન	1,70,000	1,00,000	સ્ટોક	1,00,000	80,000
પરચુરણ લેણદારો	60,000	55,000	પરચુરણ દેવાદારો	80,000	70,000
કરવેરાની જોગવાઈ	30,000	40,000	રોકડ-બેન્ક	20,000	30,000
	5,60,000	5,50,000		5,60,000	5,50,000

તા. 31/03/2022 ના રોજ પુરા થતા વર્ષ દરમ્યાન:

1. રૂ. 25,000 નું ડિવિડન્ડ ચુકવ્યું હતું.
2. અન્ય કંપનીની મિલકતો રૂ. 50,000 માં ખરીદવામાં આવી હતી જેની ચુકવણી ઈકિવટી શેર દ્વારા કરવાની હતી સ્ટોક રૂ. 20,000 અને મશીનરી રૂ. 25,000
3. રૂ. 10,000 ની અન્ય એક મશીનરી પણ ખરીદવામાં આવી હતી.
4. રૂ. 35,000 ની કરવેરાની જોગવાઈ કરી હતી.

ઉપરની માહિતી પરથી રોકડ પ્રવાહ પત્રક જરૂરી ખાતાઓ સાથે તૈયાર કરો.

અથવા

પ્રશ્ન.૨ એક કંપનીના વર્ષ 2020-21 અને 2021-22 ના પાકા સરવૈયા નીચે મુજબ છે.

જવાબદારી	2020-21	2021-22	મિલકતો	2020-21	2021-22
પ્રેફરન્સ શેર	4,00,000	5,00,000	કાયમી મિલકતો	23,20,000	25,70,000
ઈકિવટી શેર	14,00,000	14,00,000	સ્ટોક	6,60,000	5,00,000
જામીનગીરી પ્રિમિયમ	30,000	40,000	દેવાદારો	2,50,000	2,70,000
ડિબેન્ચર	5,00,000	5,00,000	બેન્ક સિલક	40,000	35,000
ચાલુ દેવા	7,30,000	6,40,000	ડિબેન્ચર વટાવ	30,000	25,000
સુચિત ડિવિડન્ડ	70,000	-----			
નફા નુકશાન ખાતુ	1,70,000	3,20,000			
	33,00,000	34,00,000		33,00,000	34,00,000

વધારાની માહિતી:

1. વર્ષ દરમ્યાન રૂ. 2,00,000 ની કિંમતના યંત્રો રૂ. 2,10,000 ની કિંમતે વેંચવામાં આવ્યા હતા.
2. વર્ષ દરમ્યાન કાયમી મિલકતો પર રૂ. 70,000 ઘસારો માંડી વાળવામાં આવ્યો હતો.
3. વર્ષ દરમ્યાન રૂ. 1,00,000 ના પ્રેફરન્સ શેર 10% પ્રિમિયમથી બહાર પાડ્યા હતા.
4. વર્ષ દરમ્યાન વર્ષ 2020-21 નું સુચિત ડિવિડન્ડ ચુકવ્યું હતું.

ઉપરની માહિતી પરથી રોકડ પ્રવાહ પત્રક જરૂરી ખાતાઓ સાથે તૈયાર કરો.

- પ્રશ્ન.૩ પ્રોડક્ટ Z નું પ્રમાણિત મિશ્રણ તેમજ માલસામાનની ખરેખર ખરીદી અને વપરાશ અંગેની વિગતો નીચે મુજબ છે. (૧૫)

કેમિકલ	પ્રમાણ		ખરેખર	
	જથ્થો (કિલો)	કિંમત રૂ.	જથ્થો (કિલો)	કિંમત રૂ.
A	25	20	2,080	22
B	10	16	840	15
C	15	40	1,280	38

દાખલ કરેલા એકમોના 10% સામાન્ય બગાડનું પ્રમાણ અંદાજેલું છે. બગાડની કિંમત નથી. ખરેખર ઉત્પાદન 3,600 કિલોગ્રામ થયું હતું.

- ઉપરની માહિતી પરથી (૧) માલસામાન ખર્ચ વિચલન (૨) માલસામાન ભાવ વિચલન અને (૩) માલસામાન વપરાશ વિચલન શોધો.

અથવા

- પ્રશ્ન.૩ કેમિકલ R ના એક પ્રમાણ મિશ્રણ અને ખરેખર વપરાશ અંગેની વિગતો નીચે મુજબ છે.

કેમિકલ	પ્રમાણ		ખરેખર	
	જથ્થો (કિલો)	કિલો દીઠ રૂ.	જથ્થો (ટન)	કુલ રૂ.
A	500	24	14	3,08,000
B	300	20	10	2,20,000
C	200	16	7	1,12,000

દાખલ કરેલા એકમોના 10% સામાન્ય બગાડનું પ્રમાણ અંદાજેલું છે. બગાડની કિંમત નથી. ખરેખર ઉત્પાદન 27 ટન થયું હતું.

- ઉપરની માહિતી પરથી (૧) માલસામાન મિશ્રણ વિચલન અને (૨) માલસામાન ઉપજ વિચલન શોધો.

- પ્રશ્ન.૪ નીચેની માહિતી પરથી મજૂરી ખર્ચ વિચલન, મજૂરી દર વિચલન અને મજૂરી કાર્યક્ષમતા વિચલન શોધો. (૧૫)

કામદારો	1 એકમ માટે પ્રમાણ			1,000 એકમ માટે ખરેખર	
	કલાક	કલાક દીઠ	કુલ રૂ.	કલાક	કુલ રૂ.
કુશળ	10	12.00	120.00	9,000	1,44,000
અર્ધ કુશળ	8	6.00	48.00	8,400	50,400
બિન કુશળ	16	4.00	64.00	20,000	72,000

અથવા

- પ્રશ્ન.૪ નીચેની માહિતી પરથી મજૂરી કાર્યક્ષમતા વિચલન અને મજૂરી મિશ્રણ વિચલન શોધો.

કામદારો	10 એકમ માટે પ્રમાણ			100 એકમ માટે ખરેખર	
	કલાક	કલાક દીઠ	કુલ રૂ.	કલાક	કુલ રૂ.
કુશળ	200	30.00	2,000	2,150	61,275
અર્ધ કુશળ	100	24.00	800	1,250	26,250
બિન કુશળ	100	15.00	500	1,200	21,600

ENGLISH VERSION

Q.1 Followings are the Balance Sheets of a company for the years 2020-21 and 2021-22: (20)

Liabilities	2020-21	2021-22	Assets	2020-21	2021-22
Preference Share	2,00,000	2,40,000	Fixed Assets	9,08,000	10,18,000
Equity Share	5,00,000	5,00,000	Stock	2,64,000	2,00,000
Security Premium	12,000	16,000	Debtors	1,00,000	1,08,000
Debenture	2,00,000	2,00,000	Bank	16,000	14,000
Sundry Creditors	2,92,000	2,56,000	Discount on Debentures	12,000	10,000
Proposed Dividend	28,000	-----			
Profit & Loss A/c	68,000	1,38,000			
	13,00,000	13,50,000		13,00,000	13,50,000

Other Information:

- 1) During the year machineries of Rs. 80,000 were sold for Rs. 84,000.
- 2) During the year fixed assets were depreciated by Rs. 28,000.
- 3) During the year Preference Shares of Rs. 40,000 were issued at 10% premium.
- 4) During the year proposed dividend of year 2020-21 was paid.

From the above information prepare Fund Flow Statement, Working Capital Statement and necessary accounts

OR

Q.1 Followings are the Balance Sheets of a company for the years 2020-21 and 2021-22:

Liabilities	2020-21	2021-22	Assets	2020-21	2021-22
Equity Share Capital	1,80,000	2,00,000	Goodwill	-----	1,600
General Reserve	20,000	24,000	Land-Building	1,80,000	1,68,400
Profit & Loss A/c	16,000	14,000	Plant-Machinery	60,000	68,000
Bank Loan	28,000	-----	Stock	40,000	32,000
Sundry Creditors	64,000	62,000	Sundry Debtors	32,000	28,000
Provision for tax	12,000	10,000	Cash-Bank	8,000	12,000
	3,20,000	3,10,000		3,20,000	3,10,000

During the year ending on 31/03/2022:

- 1) Rs. 10,000 dividend was paid.
- 2) Other company's assets were purchased against Equity Share Capital of Rs. 20,000: Stock Rs. 8,000 and Machinery Rs. 10,000.
- 3) Another machinery of Rs. 4,000 was purchased.
- 4) Rs. 14,000 transferred to Provision for tax.

From the above information prepare Fund Flow Statement, Working Capital Statement and necessary accounts.

Q.2 Followings are the Balance Sheets of a company for the years 2020-21 and 2021-22: (20)

Liabilities	2020-21	2021-22	Assets	2020-21	2021-22
Equity Share Capital	2,00,000	2,50,000	Goodwill	-----	4,000
General Reserve	60,000	70,000	Land-Building	2,10,000	1,96,000
Profit & Loss A/c	40,000	35,000	Plant-Machinery	1,50,000	1,70,000
Bank Loan	1,70,000	1,00,000	Stock	1,00,000	80,000
Sundry Creditors	60,000	55,000	Sundry Debtors	80,000	70,000
Provision for tax	30,000	40,000	Cash-Bank	20,000	30,000
	5,60,000	5,50,000		5,60,000	5,50,000

During the year ending on 31/03/2022:

- 1) Rs. 25,000 dividend was paid.
- 2) Other company's assets were purchased against Equity Share Capital of Rs. 50,000: Stock Rs. 20,000 and Machinery Rs. 25,000.
- 3) Another machinery of Rs. 10,000 was also purchased.
- 4) Rs. 35,000 transferred to Provision for tax.

From the above information prepare Cash Flow Statement and necessary accounts.

OR

Q.2 Followings are the Balance Sheet of a company for the years 2020-21 and 2021-22:

Liabilities	2020-21	2021-22	Assets	2020-21	2021-22
Preference Share	4,00,000	5,00,000	Fixed Assets	23,20,000	25,70,000
Equity Share	14,00,000	14,00,000	Stock	6,60,000	5,00,000
Security Premium	30,000	40,000	Debtors	2,50,000	2,70,000
Debenture	5,00,000	5,00,000	Bank	40,000	35,000
Sundry Creditors	7,30,000	6,40,000	Discount on Debentures	30,000	25,000
Proposed Dividend	70,000	-----			
Profit & Loss A/c	1,70,000	3,20,000			
	33,00,000	34,00,000		33,00,000	34,00,000

Other Information:

- 1) During the year machineries of Rs. 2,00,000 were sold for Rs. 2,10,000.
- 2) During the year fixed assets were depreciated by Rs. 70,000.
- 3) During the year Preference Shares of Rs. 1,00,000 were issued at 10% premium.
- 4) During the year proposed dividend of the year 2020-21 was paid.

From the above information prepare necessary statements and accounts.

Q.3 Details of Standard Mix of Raw Materials and Actual Use Raw Materials of Chemical 'Z' are: (15)

Chemicals	Standard		Actual	
	Kilograms	Price per KG (Rs.)	Kilograms	Price per KG (Rs.)
A	25	20	2,080	22
B	10	16	840	15
C	15	40	1,280	38

The standard loss in production is 10% of the input. There is no scrap value. Actual production of product 'Z' was 3,600 kgs.

From the above information find out: (1) Material Cost Variance (2) Material Price Variance (3) Material Usage Variance

OR

Q.3 Details of Standard Mix of Raw Materials and Actual Use Raw Materials of Chemical 'R' are:

Chemicals	Standard		Actual	
	Kilograms	Price per KG (Rs.)	Tons	Total (Rs.)
A	500	24	14	3,08,000
B	300	20	10	2,20,000
C	200	16	7	1,12,000

The standard loss in production is 10% of the input. There is no scrap value. Actual production of product 'R' was 27 tons.

You are required to calculate: (1) Material mix variance (2) Material yield variance.

Q.4 From the following information calculate Labour Cost Variance, Labour Rate Variance and labour Efficiency Variance: (15)

Workers	For 1 Unit Standard			For 1,000 Units Actual	
	Hours	Per hour Rs.	Total Rs.	Hours	Total Rs.
Skilled	10	12.00	120.00	9,000	1,44,000
Semi-Skilled	8	6.00	48.00	8,400	50,400
Unskilled	16	4.00	64.00	20,000	72,000

OR

Q.4 From the following information calculate Labour Efficiency Variance and Labour Mix Variance:

Workers	For 10 Unit Standard			For 100 Units Actual	
	Hours	Per hour Rs.	Total Rs.	Hours	Total Rs.
Skilled	200	30.00	2,000	2,150	61,275
Semi-Skilled	100	24.00	800	1,250	26,250
Unskilled	100	15.00	500	1,200	21,600
